

આ પત્ર જો તમને સરળ વાંચન સ્વરૂપમાં, બ્રેઈલ કે અન્ય ભાષાઓમાં જોઈતો હોય, તો કૃપા કરીને જુઓ england.nhs.uk/coronavirus/patient-letter અથવા સંપર્ક કરો england.contactus@nhs.net

પ્રતિ:

NHS England and NHS Improvement
Skipton House
80 London Road
London
SE1 6LH

31 માર્ચ 2022

કોરોનાવાઈરસની સારવારો વિશે અગત્યની માહિતી

તમારી તબીબી નોંધો હાલમાં દર્શાવે છે કે જો તમને કોરોનાવાઈરસ થાય, તો તમે તેની સારવારો મેળવવા કદાચ યોગ્ય બની શકો.

તમને કદાચ આ પત્રની અન્ય આવૃત્તિ પહેલાં મળી હશે. તેમાં સુધારા-વધારા કરવામાં આવ્યા છે કારણ કે તમે જે રીતે કોરોનાવાઈરસ માટે ટેસ્ટ કરો છો તેમાં સરકારે ફેરફાર કર્યા છે. 1લી એપ્રિલથી, તમારે કોરોનાવાઈરસનાં ચિહ્નોની તપાસ કરવા માટે લેટરલ ફ્લો ટેસ્ટ્સ વાપરવાના રહેશે, PCR ટેસ્ટ નહિ.

આ પત્ર સમજાવે છે કે:

1. તમારે લેટરલ ફ્લો ટેસ્ટ્સ ઘરે રાખવા જોઈએ
2. જો તમને કોરોનાવાઈરસના લક્ષણો હોય તો તમારે ટેસ્ટ કરવો જોઈએ. અગત્ય: તમારે તમારા ટેસ્ટના પરિણામની જાણ કરવી જ જોઈએ.
3. જો તમારા ટેસ્ટનું પોઝિટિવ પરિણામ આવશે, તો સારવારો વિશે NHS તમારો સંપર્ક કરશે.

વધુ માહિતી માટે જુઓ: www.nhs.uk/CoronavirusTreatments

અમે શા માટે તમને આ પત્ર મોકલી રહ્યાં છીએ?

આરોગ્ય નિષ્ણાતોએ આરોગ્યની એવી પરિસ્થિતિઓ પર નજર નાંખી છે જેના લીધે લોકો પર કોરોનાવાઈરસનું વધુ જોખમમાં મૂકાય છે. યુ.કે.ના ચીફ મેડિકલ ઓફિસરો દ્વારા આરોગ્યની તે પરિસ્થિતિઓને સંમતિ આપવામાં આવી છે.

તમારા તબીબી રેકોર્ડ્સ દર્શાવે છે કે તમને તેમાંથી એક અથવા વધુ આરોગ્યની પરિસ્થિતિઓ છે. આનો અર્થ એ છે કે જો ટેસ્ટ તમને કોરોનાવાઈરસ હોવાનું ચોક્કસ થાય, તો આ સારવારો તમારા માટે યોગ્ય હોઈ શકે છે.

આ સારવારો તમને ગંભીરપણે બીમાર પડતાં રોકી શકે છે અને તમને જેવાં ચિહ્નો દેખાવાનું શરૂ થયા એટલે ઝડપથી તે આપવી જરૂરી છે.

1. તમારે લેટરલ ફ્લો ટેસ્ટ્સ ઘરે રાખવા જોઈએ

યુ.કે. હેલ્થ સિક્યોરિટી એજન્સી તમને 12 એપ્રિલ સુધીમાં લેટરલ ફ્લો ટેસ્ટ્સનું એક પેક મોકલી આપશે. તમને ચિહ્નો શરૂ થાય ત્યારે જ તેનો ઉપયોગ કરો. જો તે ખલાસ થઈ જાય, તો તમે વધારે ટેસ્ટ્સ પરથી <https://www.gov.uk/order-coronavirus-rapid-lateral-flow-tests> અથવા 119 પર ફોન કરીને મંગાવી શકો છો.

તમે સરકાર દ્વારા પૂરા પાડવામાં આવેલા કોઈ પણ લેટરલ ફ્લો ટેસ્ટ્સ વાપરી શકો છો. દુકાનમાંથી ખરીદેલા ટેસ્ટ્સ હાલમાં GOV.UK પર 119 મારફતે રજિસ્ટર કરી શકાતા નથી, અને જો આ ટેસ્ટ્સ વાપરીને તમારું પોઝિટિવ પરિણામ આવશે, તો સારવાર વિશે તમારો સંપર્ક કરવામાં આવશે નહિ.

જો તમને આ પહેલાં PCR ટેસ્ટ મોકલવામાં આવ્યો હોય તો તે તમે રાખી શકો છો. જો તમને NHS તરફથી સારવાર મળતી હોય, તો તમને કદાચ PCR ટેસ્ટ કરવાનું કહેવામાં આવી શકે.

2. જો તમને કોરોનાવાઈરસનાં ચિહ્નો હોય તો તમારે ટેસ્ટ કરવો જોઈએ.

જો તમને કોરોનાવાઈરસનાં ચિહ્નો હોય તો તમારે તરત જ લેટરલ ફ્લો ટેસ્ટ કરવો જોઈએ, ભલે પછી ચિહ્નો ગમે તેટલાં હળવાં હોય.

તમારે તમારા ટેસ્ટનું પરિણામ <https://www.gov.uk/report-covid19-result> પર જઈને અથવા 119 પર ફોન કરીને જણાવવું જ જોઈએ. તમારો NHS નંબર અને પોસ્ટકોડ સચોટપણે આપવાનું અગત્યનું છે જેથી તમારો સંપર્ક થઈ શકે.

જો તમારા ટેસ્ટનું પરિણામ નેગેટિવ આવ્યું હોય પણ તમને હજુયે ચિહ્નો હોય, તો તમારે આગામી બે દિવસ સુધી દરરોજ ટેસ્ટ કરવો જોઈએ (એટલે કે ત્રણ દિવસના સમયમાં ત્રણ વાર ટેસ્ટ).

3. જો તમારા ટેસ્ટનું પોઝિટિવ પરિણામ આવશે, તો સારવારો વિશે NHS તમારો સંપર્ક કરશે.

જો લેટરલ ફ્લો ટેસ્ટસમાંથી કોઈનું પણ પોઝિટિવ પરિણામ આવે, અને તમે તે પરિણામની જાણ કરી હશે, તો NHSએ સારવાર વિશે તમારો સંપર્ક કરવો જોઈએ. જો તમારા ટેસ્ટના પોઝિટિવ પરિણામના 24 કલાકની અંદર તમારો સંપર્ક કરવામાં ન આવે, તો કૃપા કરીને તમારા GP અથવા 111નો અથવા તમારા નિષ્ણાત ક્લિનિશ્યનનો સંપર્ક કરો (જો હોય તો) જેઓ તાત્કાલિક રીફરલ કરી શકશે.

આપના વિશ્વાસુ

પ્રોફેસર સ્ટીફન પોવિસ

નેશનલ મેડિકલ ડાઈરેક્ટર

NHS England and NHS Improvement

NHS એ તમારી માહિતીનો કેવી રીતે ઉપયોગ કર્યો છે તેના પર વધુ માહિતી માટે:

www.digital.nhs.uk/coronavirus/treatments/transparency-notice.